



Price ` 5/-

{ khtl ÖËP }

Ø»kø 11, ylf-129, 15 MkkAxBçkh, 2020

fksplk kSMx

zli rölkik MM84-k	+91-99250 15056	zli r{.lk [ok	+91-98240 22107
zli rölkik fdkp	+91-98240 99848	zli W{.k pkn	+91-98250 66939
zli mksM ðe. Álkxu	+91-89403 05130	zli nufkik ckuk	+91-98250 30111
zlp rmhk fñzepk	+91-98254 65205	zli yr{.k [Ehklyk	+91-98250 96922
zli okyñdk Álkxu	+91-98240 61266	zli ysp LMRF	+91-98250 82666
zli fdpk Álkhe	+91-98250 26999	zli Mkp omñlk	+91-99250 45780

Ákerzþlxðf fksplk kSMx

zli f-pk pkr	+91-99246 12288	zli r{.lk [ok	+91-98240 22107
zli r{.lk pkr	MkZedk	+91-82383 39980	

fksplk Msbk

zli Äehlik pkn	+91-98255 75933
zli Äð÷ Lkpf	+91-90991 11133
zlp yr{.k [Ehk	+91-96990 84097
zlp rfpk pkn	+91-99142 81008
Ákerzþlxðf yLkumxð[h- nkoxMsbk	
zli pdkp pkn	+91-98250 44502

fksplk kSMx, Ükkhkf kMef yLku

Ükkhkf kMef kMef Msbk	
zli y{.k {khe	+91-99240 84700

fksplk yLkumxð

zli rölkik yLkumxð	+91-98795 71917
zli rmhk Álkxu	+91-95863 75818
zli r{.lk pkr	+91-91732 04454
fksplk R{.okhVrsplk kSMx	
zli ysp LMRF	+91-98250 82666
zli rölkik MM84-k	+91-99250 15056
zlp rmhk fñzepk	+91-98254 65205
Lkeylkxð kSMx yLkumxð	
zli yr{.k r{.lk pkr	+91-90999 87400



JCI



NABH



NABH ER



ACC
International
Centers of Excellence

କିମ୍ବା ହୋସିପିଟଲ



Balloon Expandable Valve



Self Expanding Supra-Annular Valve

15

TAVI

(ଖର୍ମକର୍ମିକୁ ଯୁଗମେ ଦେଇ ଏବା କାଳିପାଲିକା)

ମଧ୍ୟାବ୍ଧୀ ଦେଇ ହାତକରିମିକ ଦେଇ ଦେଇ

ଚକରେ ଦେଇ କାଳିପାଲିକା

ଦେଇ ଦେଇ କାଳିପାଲିକା

ନିର୍ମାଣ ଦେଇ 100 % ମଧ୍ୟାବ୍ଧୀ ମଧ୍ୟାବ୍ଧୀ

ଦେଇ ଦେଇ ଯୁଗମେ ଓପରା ମଧ୍ୟାବ୍ଧୀ ମଧ୍ୟାବ୍ଧୀ ଦେଇ

ମଧ୍ୟାବ୍ଧୀ ନିର୍ମାଣ ଦେଇ

ଦେଇ ଦେଇ କାଳିପାଲିକା ଦେଇ ଦେଇ ଦେଇ ଦେଇ
ଦେଇ ଦେଇ ଦେଇ ଦେଇ ଦେଇ ଦେଇ ଦେଇ

ଫିଲ୍ମିଲ୍କ ଦେଇ ମଧ୍ୟାବ୍ଧୀ ନିର୍ମାଣ ଦେଇ
ଦେଇ ଦେଇ ଦେଇ ଦେଇ ଦେଇ ଦେଇ ଦେଇ ଦେଇ

ଦେଇ ଦେଇ ଦେଇ ଦେଇ ଦେଇ ଦେଇ
ଦେଇ ଦେଇ ଦେଇ ଦେଇ ଦେଇ ଦେଇ ଦେଇ

ଦେଇ ଦେଇ ଦେଇ ଦେଇ ଦେଇ
ଦେଇ ଦେଇ ଦେଇ ଦେଇ ଦେଇ ଦେଇ




યાંક્રિએલ્ક્રોનિક્કુરીસ : યાંસ્પ્રેક્ટિકિંગ

હૃદયની ધમનીઓના રોગમાં હૃદયની ધમનીઓ સાંકડી થઈ જાય છે અથવા તો તેમની અંદર અવરોધ પેદા થાય છે. તેના કારણો હૃદયને પૂરતું લોહી મળતું અટકી જાય છે.

લોહીનો પુરવઠો અને તેની માંગના આ વસ્તુવિચારને સમજાવવાની અહીં જરૂર છે. હૃદયને જરૂર હોય છે લોહીની, કારણ કે તેણે એટલું બધું કામ કરવું પડે છે. એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસ શસ્ત્રક્રિયા વડે રૂંધાયેલી વાહિનીઓને ખોલીને આપણો તેને વધારે લોહી પહોંચતું કરી શકીએ.

પી.ટી.સી.એ. (PTCA)

પી.ટી.સી.એ. એ ટલો પરક્યુટેનીઅસ ટ્રાન્સલ્યુમિનલ કોરોનરી એન્જિયોપ્લાસ્ટી. 'આ કાર્યપદ્ધતિ વડે હૃદયની ધમનીને પહોળી કરીને તેનો અવરોધ હટાવી શકાય છે. પી.ટી.સી.એ. બાયપાસ ઓપરેશનના શસ્ત્રક્રિયા વગરનો વિકલ્પ છે, અને તે હથ અને સાથળમાં એક નાનું છિદ્ર પાડીને કરી શકાય છે. આ કાર્યપદ્ધતિ વખતે દર્દીને બેહોશ કરવો પડતો નથી. દર્દી જાગૃત હોય છે. આ ઉપરાંત હોસ્પિટલમાં ફક્ત ૧-૨ દિવસ જ રહેવું પડે છે.



ઇન્જેક્શન વડે બોશુદ્ધ કરવામાં આવે છે. સાંકડી સ્ટો (ર્ઝિન્ડ્સ) જેવી એક નાની નજીને હથ અને સાથળની ધમનીમાંથી પસાર કરવામાં આવે છે.

આ નાનીમાંથી ખાસ આકારનું માર્ગદર્શક કેંધેટર પસાર કરવામાં આવે છે અને તેના છેડાને હૃદયની ધમનીમાં સરકાવવામાં આવે છે.

હવે હૃદયની ધમનીમાંના અવરોધમાંથી એક પાતળા વાયરને આરપાર પસાર કરવામાં આવે છે. આ વાયરની ઉપરથી, અવરોધના સ્તર સુધી એક પાતળા ફુલાવી શકાય તેવા ફુગ્ગાને પસાર કરવામાં આવે છે. ફુગ્ગો બરોબર અવરોધની જગ્યાએ આવે એટલે તે ફુગ્ગાને ફુલાવવામાં આવે છે. આ ફુગ્ગો ચરબીના થર ઉપર દબાણ આપીને અને ધમનીને ખેંચીને અવરોધને ખુલ્લો કરે છે.

સામાન્ય રીતે ફુગ્ગા વડે એન્જિયોપ્લાસ્ટી કરવાથી ધમની પોતાના મૂળ માપના પ્રમાણમાં ૭૦-૮૦ ટકા ખુલ્લી જાય છે. તેમાં હજુ થોડો અવરોધ તો રહે જ છે, જેના માટે સૌથી અદ્ભુત સાધનોમાંના એક એટલે કે 'સ્ટેન્ટ'નો ઉપયોગ કરવામાં આવે છે.

સ્ટેન્ટ

હવે મોટા ભાગની એન્જિયોપ્લાસ્ટીમાં સ્ટેન્ટનો ઉપયોગ થાય છે. તે બોલપેનની સ્થિરગાળા કદનું, નાનકડી સ્થિરગ જેવું ધાતુનું સાધન છે. સ્ટેન્ટ મૂકતાં પહેલા અવરોધને ફુગ્ગા વડે ખોલવામાં આવે છે. પછી સ્ટેન્ટને એન્જિયોપ્લાસ્ટીના ફુગ્ગા ઉપર બંધ પરિસ્થિતિમાં બેસાડીને અવરોધની જગ્યાએ ઘડેલવામાં આવે છે. જ્યારે એન્જિયોપ્લાસ્ટીના ફુગ્ગાને ફુલાવવામાં આવે છે ત્યારે તે સ્ટેન્ટને રક્તવાહિનીની દીવાલ સામે ખોલે છે. આ સ્થિતિમાં સ્ટેન્ટ બેસી જાય છે અને ધમનીને ખુલ્લી રાખે છે. અંતમાં ફુગ્ગાવાળા કેંધેટરને શરીરની બહાર કાઢી લેવામાં આવે છે.

સ્ટેન્ટના ફાયદા

સ્ટેન્ટ વાપરવાથી ધમની પ્રમાણમાં વધારે ખૂલે છે અને ફરીથી તે રૂંધાઈ જવાની શક્યતા ઘટી જાય છે. દાખલા તરીકે ૬૦ ટકા



રૂંધાયેલી એક ધમનીની કલ્પના કરીએ. ફુંગા વડે એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી અવરોધ ૨૦ ટકાથી ૩૦ ટકા સુધી ઓછો થઈ જશે, પણ સ્ટેન્ટ મૂક્યા પછી અવરોધ ૦ ટકા થઈ જશે. અવરોધ બિલકુલ હટી જશે. આ ઉપરાંત, જ્યારે રૂંધાયેલી હૃદયની ધમનીની ફક્ત ફુંગાવાળી કાર્યપદ્ધતિથી સારવાર કરવામાં આવે છે, ત્યારે અવરોધ ફરીથી પેદા થવાની શક્યતા આશરે ૩૦ ટકા રહે છે. પરંતુ જો સ્ટેન્ટ મૂકવામાં આવી હોય, તો અવરોધ ફરીથી ઊભો થવાની અને એન્જાયનાનાં લક્ષણો પેદા થવાની શક્યતા છેક ૧૦ ટકા સુધી ઘટી જાય છે. આથી, સ્ટેન્ટનો ઉપયોગ કરવો તે એક આવશ્યક કાર્યપદ્ધતિ થઈ ગઈ છે. જો સ્ટેન્ટ મૂક્યા પછી છ મહિના સુધી અવરોધ પેદા ન થાય, તો રૂંધાયેલી ધમની હંમેશા માટે ખુલ્લી રહે છે. સ્ટેન્ટ વાળી ધમનીમાં છ મહિનાની અંદર ફરીથી અવરોધ પેદા થવાની શક્યતા ૧૦ ટકા છે. આ રીતે, જો અવરોધ છ મહિના સુધીમાં ઊથલો ન મારે તો સ્ટેન્ટ વડે મોટા ભાગના અવરોધનું કાયમ માટે નિવારણ થઈ જાય છે.



‘ડી.ઇ.એસ’ ડ્રગ કોટેડ સ્ટેન્ટ્સ

હવે એક ખાસ પ્રકારની દવાના આવરણવાળી સ્ટેન્ટ પણ મળે છે, કે જે બેસાડ્યા પછી થોડાં અઠવાડિયાં સુધી તે

Röthkük-ePBMI, Iraklikkuk-ePBMI, રોપામાયસિન અથવા પેંકિલેક્સલ જેવી દવા છોડતી રહે છે. આથી સોજો અને ધમનીની માંસપેશીનો વધુ પડતો પડતો વિકાસ થતાં અટકે છે અને ધમનીમાં ફરીથી અવરોધ પેદા થવાની શક્યતા ર થી ૫ ટકા જેટલી ઓછી થઈ જાય છે. અમેરિકામાં હવે ૮૦ ટકાથી વધુ આ પ્રકારની સ્ટેન્ટ જ વપરાય છે. હવે નવી અધતન દવાઓ નો વપરાશ થાય છે અને ઓગળી જાય એવી (Bioabsorbable Stent) સ્ટેન્ટ પણ વપરાય છે.

જમેલા લોહીને ઓગાળનારા નવા પદાર્થ

આ હોય છે ‘લેટેલેટ ટૂ-બી/શ્રી-એ’ પ્રતિબંધકો. દવાઓનું આ એક એવું જૂથ છે જે લેટેલેટ્સ (લોહીને જામવામાં મદદ કરતા રક્ત કોષો)ને ઓછા ચીકણા બનાવે છે અને લોહીને જામી જતું રોકવામાં મદદ કરે છે. આ દવાઓનો ઉપયોગ સ્ટેન્ટના વખતે કરવામાં આવે છે, કારણ કે જો સ્ટેન્ટની નજીક લોહી જામી જાય તો એન્જિયોપ્લાસ્ટીની બધી મહેનત અને ખર્ચ પાડીયામાં જાય. ‘લેટેલેટ ટૂ-બી/શ્રી-એ’ પ્રતિબંધકોના દાખલા છે ઓફિસિસિબેચ (રિઓપ્રો), એપિફિબાટાઇડ (ઇન્ટિગ્રિલિન) અને ટાયરોફિબાન. આ દવાઓ સ્ટેન્ટની નજીક લોહી જામી જતું રોકે છે. આજકાલ તેનો ઉપયોગ અસ્થિર એન્જાયના અથવા હૃદયરોગના હુમલા પછી અથવા એન્જિયોપ્લાસ્ટી દરમ્યાન પણ કરવામાં આવે છે.

એન્જિયોપ્લાસ્ટીમાં અન્ય સાધનો

એન્જિયોપ્લાસ્ટી વખતે કેટલાંક અન્ય સાધનો વપરાય છે. એક છે પરિભ્રમણ કરતી ટ્રિલ, જે હૃદયની ધમનીમાંથી ચરણીના થરને સાફ કરવા માટે મદદકૃપ બને છે. ડાયરેક્શનલ કોરોનરી ઓથિરેક્ટોમી સાધન એક પરિભ્રમણ કરતું કટર વાપરે છે, જે ધમનીના અવરોધને છોલી નાંબે છે. ક્યારેક ખાસ ‘કટિંગ’ કરતા ખાસ ફુંગા ધમનીને ખોલવા માટે વાપરવામાં આવે છે. ધમનીનો અવરોધ બાળવા માટે લેસર કિરણોનો ઉપયોગ થયો છે, પણ



“MkeBMk EMX” nk̄MÃkx ÷ (LkkLk-fk̄ðz nk̄MÃkx ÷)

fk̄ðz {nk{kheLkk Mk{P{kt nkE heMf Mkshe{kt Lkðk rfíke{klk MÚkkrÃkík

fk̄ðz Lke ðri' f {nk{kheLke Mkkhðkh{kt y^{1/4}íkðofk{økehé



{k[0]

y^{1/4}÷

{u}



st



stE

- x^{1/4}LkA ÷ kLx
- S.ykE. Mkshe
- y^{1/4} ÷ kLx
- Lkðk y^{1/4} MkkELk Mkshe
- fk̄ðz Pkf MkkPLMk
- ðkMÖPifh
- fLmkh Mkshe
- E.y^{1/4}.xe.

fk̄ðz {nk{khe Ëhr{PkLk çkÄe S LkkLk-fk̄ðz rck{kheLke ©X Mkkhðkh

MkeBMk nk̄MÃkx ÷

ÓEP «íPkhkâky {kxu
økshkíkLkMkkÜke «Úk{ yLkuyf{kók flý

100th

nkxoX^{1/4}LkA ÷ kLx

stE 2020

MkeBMk nk̄MÃkx ÷

zoom LIVE



MÖkMÜP MktðkË MkeBMk fuMkkÜk

Ëh hrððkhMkðkh 11 f ÷ kf uLkðk rð»kPkuMkkÜku

yk ÅkrhMktðkË {kt ÒzLkðk {kxu
y{khk {kçkkE ÷ Lkçkh Åkh {Mks fhu
+91 9099066538

ík{kÁ <Lkk{><E{u= yezUk>
<{kçkkE ÷ >

તેમાં ખાસ સફળતા મળી નથી.

એન્જિયોપ્લાસ્ટીમાં

અધતન શું છે?

અમુક કિ સસાઓમાં હદ્યની ધમનીને પૂરેપૂરી ખોલવા છતાં તેમાંથી લોહી વહેતું નથી, કારણ કે ચરબીના થરનો સૂક્ષ્મ કચરો જીણી જીણી

રક્તવાહિનીઓના રસ્તામાં અવરોધ પેદા કરે છે. ડિસ્ટલ પ્રોટેક્શન ડિવાઈસ અથવા ફિલ્ટર ડિવાઈસ ચરબીના આવા સૂક્ષ્મ કચરાને દૂર કરી આમ થતું અટકાવે છે.



એન્જિયોપ્લાસ્ટીમાં વપરાતાં સાધનો

કંચ લેંબની બહાર

એન્જિયોપ્લાસ્ટીમાં ૩૦ થી ૫૦ કિનિટ લાગે છે. ભાગ્યે જ તેથી વધુ સમય લાગે. એ એક બીમાર હદ્યને વિના કાપકૂપે નવપલ્લવિત કરનારી ચમત્કારિક 'પ્રોસિજર' છે. ૮૦ થી ૮૫ ટકા દર્દીઓમાં એ કાયમ માટે શસ્ત્રક્રિયાની જરૂરિયાતને દૂર કરે છે.

આધુનિક સગવડો અને કિંમત વિશે ...

વધતી ઉંમર સાથે હું આધુનિક ટેકનિકવાળી સગવડોને આપણી

જિંદગીમાં પગપેસારો કરતી જોઉં છું. આવી એક વસ્તુ છે 'સ્ટેન્ટસ'. નળાકાર ધાતુના તારની જાળ જેવું આ ઉપકરણ હું ધમનીઓને ખોલવા તેમાં દાખલ કરું છું. હવે આવાં સ્ટેન્ટસને



સ્ટેન્ટની જાળી પર દવાનું પડ હોય છે.

વિશિષ્ટ દવાનું આવરણ ચ્યાવાય છે, જે ધમનીઓને ફરીથી બંધ થતી અટકાવે છે. તેમને 'ડ્રગ કોટેડ સ્ટેન્ટસ' કહેવાય છે. જો કે તે ખૂબ જ ખર્ચાળ હોય છે. એથી જ્યારે આવા સ્ટેન્ટસનો તાત્કાલિક ધોરણે ઉપયોગ કરવાનો હોય અને દર્દી પાસે પૈસાની સગવડ ન હોય ત્યારે હું પોતે ડિપોઝિટ ચૂકવી દઉં છું અને આ મુજબ આવા સ્ટેન્ટસ તેમને ઊછીની આપું છું. સ્વાસ્થ્યસુરક્ષા એટલી હુદે ખર્ચાળ બની છે કે મને ખૂબ જ હુંખ થાય છે. કોઈ પણ તેની કિંમત ઘટાડવા સફળ પ્રયત્નો કરતું નથી. વિદેશથી મંગાવાતા સ્ટેન્ટસ, પેસમેકર્સ, અવયવો અને સાધનોની કિંમત ખૂબ ઊંચી હોવાથી ખૂબ જ ઓછા લોકો તેને ખરીદી શકે છે.

તેનો ઉપાય છે મોટાભાગના લોકો માટે સરકાર દ્વારા અપાતો ઓછા પ્રિમિયમનો વીમો. રોટી, કપડાં અને મકાન એ આપણી સરકારની સૌમયમ ફરજ હતી. બીજી ફરજ છે દરેક વ્યક્તિને સ્વાસ્થ્ય સગવડ. આપણે મોજશોખમાં ખર્ચ કરવાને બદલે બચત કરવી અને આપણા સ્વાસ્થ્ય માટે સૌથી ઉત્તમ વસ્તુ વાપરવાનો આગ્રહ રાખવો.

RLxJlyykykx f ck÷lk ākbāk

ઇન્ટ્રાએઓર્ટિક બલૂન પભ્ય (આઈ.એ.બી.પી.) ખૂબ જ ગંભીર રીતે બીમાર લોકોના હદ્યને પભ્ય કરવા મદદ કરે છે. આ સાધન થોડા સમય માટે જ વપરાય છે. પણ તે દર્દીના જીવન અને મોત વચ્ચેની સંરક્ષક દીવાલ બની દર્દીનો જાન બચાવે છે.

ઉપયોગ

આઈ.એ.બી.પી. હદ્યની મોટી શસ્ત્રક્રિયા બાદ નબળા હદ્યને સારવાર રૂમમાં ટેકો આપે છે. કેટલીક વખત ખૂબ જ ગંભીર રીતે બીમાર લોકોના હદ્યને મદદ કરવા આઈ.એ.બી.પી. વપરાય છે.

દર્દી જ્યારે શસ્ત્રક્રિયા અથવા એન્જિયોપ્લાસ્ટીની રાહ જોતા હોય અને દર્દીની હદ્યની ધમનીઓ વધારે પ્રમાણમાં બંધ હોય ત્યારે આઈ.એ.બી.પી.થી દર્દીના



લોહીનો પ્રવાહ સુધરે છે. કાર્ડિયોજેનીક શોક એવી ગંભીર અવસ્થા હોય છે જેમાં હદ્ય નબળું પડ્યું હોવાને લીધે તે બહુ ઓછું પમ્પિંગ કરે છે અને દર્દીના શરીરને જોઈએ એટલું લોહી મળતું નથી. દર્દીનું બી.પી. ઘટી જાય છે, તેના હાથપગ ઠંડા પડી જાય છે અને તાત્કાલિક છલાજ ના કરવામાં આવે તો દર્દીનો જાન જઈ શકે. એવી હાલતમાં આઈ.એ.બી.પી. જ્યાં સુધી દર્દીને સારું ના થાય અથવા કોરોનરી એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ સર્જરી કરી પમ્પિંગ સુધારવામાં ના આવે ત્યાં સુધી મદદરૂપ બની રહે છે.

કેવી રીતે કાર્ય કરે છે?

આઈ.એ.બી.પી. એક લાંબી નળી (કંથેટર) હોય છે. એની ટોચ પર ૮ ઈંચ લંબાઈનો પ્લાસ્ટિક ફુંગો હોય છે જે ફુલાવી શકાય છે.

કેંદ્રોને દર્દીના હથ અને સાથળની ધમનીમાં દાખલ કરાય છે. નળી દાખલ કરેલા ભાગને બહેરો કરવા હંજેકશન અપાશે, પરંતુ દર્દી જગૃત અવસ્થામાં રહેશે. ડૉક્ટર ધમની મારફતે નળીને દોરે છે અને તેની એઓર્ટા (મહાધમની)માં બેસાડે છે. એક પમ્પ કેંદ્રોના છેડા પર જોડાય છે. આ ફુંગો જડપથી ફુલાય છે અને દર્દીના પોતાના જ હદ્દયના ધબકારાના ઉપયોગથી તેની હવાનો નિકાલ થાય છે. આ ફુંગો હદ્દયના દરેક ધબકારાના સ્થગિત સમયે શરૂઆતમાં ફૂલે છે. આ ફુલાયેલ ફુંગો એઓર્ટમાં બ્લડપ્રેશર વધારે છે, હદ્દયની

ધમનીઓ અને શરીરમાં લોહીના પ્રવાહને વધારે છે અને હદ્દય ઉપરના શ્રમને ઘટાડે છે.

પરિણામો

ખૂબ જ ગંભીર રીતે બીમાર લોકો માટે આઇ.એ.બી.પી. ખૂબ કામનું સાધન છે.

MISLP 'OEPlikે ડીકિ રેદીલે' - ડીફ્ફ્યુલ્ફિલ્મેન્સ

"MkeBMk EMx" ન્કેમાક્સ દિવસ

(Lkklkk-fknodz nkemakxd)

મક્સફદ્વિ યલકુ{વેફદ્વિ {ઓખે-માક્સપકદેખે મક્કોક્યુ24 x 7 વાકદ્વિચા



મનુષ્યકીય મસ્ટે મક્સિક્સ ક્રિયાનુભૂતિ

એકે મકદુક કે {ક્ષુર્દ્ભાન ક્રિક્ષાનુભૂતિ
ક્રિક્ષા ક્રમકુદ્વિ ક્રિક્ષા એન્ડોર્ન્સ (PPEs)

ચુક્કુર્કુંડ્યોક લે યદ્વોક મક્કોક્યુ
યદ્વોક ઉકે ફિલ્મખ યલુહુર્પ્રકુંન્કાકે મક્કુલ્ખ

3.5 યફ્ફ સેલ્ક ક્ષા
500,000 મફ્ફ્દું વિક ક્લુયદ્વોક ર્કુંડ્યોક

"Maru Hriday" Registered under RNI No. GUJGUJ/2009/28044

Published 15th of every month

Permitted to post at PSO, Ahmedabad-380002 on the 22nd to 27th of every month under
Postal Registration No. GAMC-1731/2019-2021 issued by SSP Ahmedabad valid upto 31st December, 2021
Licence to Post Without Prepayment No. PMG/HQ/090/2019-2021 valid upto 31st December, 2021

If undelivered Please Return to :

CIMS Hospital, Nr. Shukan Mall,

Off Science City Road, Sola, Ahmedabad-380060.

Ph. : +91-79-2771 2771-72

Fax: +91-79-2771 2770

Mobile : +91-98250 66664, 98250 66668

'{KY ÖEP' Lkku ytf {pxÖölk ybku: òu ík{khk '{KY ÖEP' Lkku ytf òRíkkunlök lkku lkku rfxk'ik` 60 (12 ytf) Au lkku {pxÖölk {xu fip yúlk ök [f/zeze 'MkeBMk nkñmálx ÷ «k. ÷e. ' Lkk Lkk{Lkkurk{khk Lkk{ y™u ík{khk Áldn ríkk yzéllk rðókrik MkkÚku y{khk ykaVmk, "{KY ÖEP' rzÁlkxqfjlx, MkeBMk nkñmálx ÷, bflk {k LkSF, yku/ MkkPLMK Mkkex hkkz, Mkkak, y{ÉkkE-380060 Ákk {kf ÷e ykkpku Vkkk Lkk : +91-79-4805 1059/1060

MkeBMk nkùMĀkx ÷



Y{ahfk Lþþí ðef {økú eLk (2020) {kt
½khík yLkurði Lke ©uX nkAMÃkx÷ku{klke yf íkhefuMÚkkLk

R.yM.ykR. rzMukMhelke M_k{u E_k h h_k, y{E_kKE-38004 ¾k_klikke A_kblyLku
MeB_M nk_Ml_kx÷, p_kfL {k_k LkSF, y_kW M_kbL_M Mexe h_k, M_k-k, y{E_kKE-380060 ¾k_klikke «rM_O fP_k